

# અભિસંધાન દ્વારા અધ્યયન/રિષ્ટક્ષણ

વર્તનના બે પ્રકાર (૧) પ્રતિચારાત્મક (૨) કારક વર્તન


તે પ્રમાણે અભિસંધાનના બે પ્રકાર

(૧) પ્રતિચારાત્મક વર્તનનું અભિસંધાન એટલે પ્રશિષ્ટ(શાસ્ત્રીય) અભિસંધાન  
(Classical Conditioning)


(૨) કારકવર્તનનું અભિસંધાન એટલે કારક અભિસંધાન  
(Operant Conditioning)

# પ્રશિષ્ટ અભિસંધાન

- રશીયન શર્કીરશાહશ્રી –  
ઇવાન પાવલોવ
- ઇ.સ. ૧૯૦૪ માં  
પૈદકશાહ્રમાં નોબેલ  
પારિતોષિક
- કૂતરા પર પ્રયોગ




# સાધન રચના



- ફૂતરાને પહુંચા બાંધી ચોકઠામાં
- ફૂતરાના મોમાં ઓપરેશન દ્વારા કાળાં પાડી રબરની નળી લાળ ગ્રંથી સાથે જોડી
- નળીનો બીજો છેડો એક પાત્રમાં રાખ્યો, જેમાં લાળ રસ એકઠો થાય અને માપન થાય
- ફૂતરાને એક ખંડમાં - બહારની વ્યક્તિ તેને જોઈ શકે પણ ફૂતરો ન જોઈ સકે
- ફૂતરાને ખોરાક, અવાજ કે પ્રકાશ આપી શકાય તેવી વ્યવસ્થા

# प्रयोग रीत



- भूम्यो कूतरो - शांत स्थितिमां राखी पछी धंटडीनो अवाज – अवाज सांभળी कूतराए कान उँचा कर्यापछी तरत ज खोराक आप्यो कूतराने लाग झरी
- उपरनी किया वारंवार
- कूतराने मात्र धंटडीनो अवाज सांभળी लाग झरी
- आवुं वारंवार करवामां आव्या पछी लाग झरती नहोती
- खोराक आपवानी शऱ्हआत कर्यापछी लाग झरी

# મૂળ ઉદ્દીપક : ખોરાક

## સ્વાભાવિક પ્રતિચાર : લાળ ઝરવી

### અવેજુ ઉદ્દીપક : ઘંટડી

- અભિસંધાન : મૂળ ઉદ્દીપક સાથે કુદરતી રીતે જોડાયેલા સ્વાભાવિક પ્રતિચારની અવેજુ(ધેકલિપક) ઉદ્દીપક સાથે જોડાઈ જવાની કિયા એટલે અભિસંધાન
- સમય સામીચ્ય : અવેજુ ઉદ્દીપક પછી તરત જ મૂળ ઉદ્દીપક નહીં તો.....
- નિરાભિસંધાન (વિલોપન) : અવેજુ પછી મૂળ ઉદ્દીપક રજૂન થાય તો
- પુનઃપ્રાપ્તિ : અભિસંધાન તૂટી ગયા પછી મૂળ ઉદ્દીપક રજૂ કરવામાં આવે તો ફરી અભિસંધાન

**અદ્યયનની વ્યાખ્યા : અદ્યયન એટલે મૂળ ઉદ્દીપકની સાથે સ્વાભાવિક રીતે જોડાયેલા પ્રતિચારને અવેજુ ઉદ્દીપક સાથે જોડવાની કિયા**

- ઉદાહરણો
- ખાખી કપડા પહેરેલ વ્યક્તિતને ચોર પોલીસ માને
- વિધાર્થીને જે શિક્ષક ઓછા ગમતા હોય તેમનું શીખવવાનું પણ ઓછું ગમે
- શિક્ષક વર્ગમાં દાખલ થાય એટલે વિધાર્થી ઊભા થઈ જાય
- વંદા / ગરોળીના મોડેલથી બીક લાગવી
- ઘંટ વાગે એટલે.....
- સફેદ કપડા પહેરીને લોકો એકઠા થયા હોય ત્યારે.....

# શૈક્ષણિક ફલિતાર્થો

- ભાવાવેશોનું શિક્ષણ : છોધ, આનંદ, ભય વગેરે શીખવવા
- ભાષા શિક્ષણ : વિરોધી, સમાનાર્થી, ઢિપ્રચ્યોગ વગેરે
- શિસ્ત : વખાળ કે ઠપકાના કારણો
- સુટેવો : પ્રામાણિકતા, નિયમ પાલન, ચોકસાઈ વગેરે